

તા. ૧૨.૦૮.૨૦૨૧ ના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પાંચમો પોલીટેકનિક
અભ્યાસક્રમોનો પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોલીટેકનિક અભ્યાસક્રમોનો પાંચમો પ્રમાણપત્ર વિતરણ સમારોહ તા. ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માન. કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ડો. કે. બી.કથીરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો. સદર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માન. કલેક્ટરશ્રી, આણંદ જિલ્લો, શ્રી એમ. વાય. દક્ષિણી; અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આણંદ જિલ્લો, શ્રી બી.જી. પ્રજાપતિ; તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સદર કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની જુદી જુદી પાંચ પોલીટેકનિકના વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ઉત્તીર્ણ થયેલ કુલ ૧૫૪ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ તેમજ ૫ ગુણવાન વિદ્યાર્થીઓને સુવર્ણ પદકો એનાયત કરવામાં આવેલ.

આ પ્રસંગે અતિથિ વિશેષ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આણંદ જિલ્લો શ્રી બી.જી. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેઓ પ્રાયોગિક કાર્યો તરફ વધુ ધ્યાન આપે તેવું સૂચન કરેલ જેથી તેઓ ખરે-ખર ખેડૂતના ખેતરે ઉદ્ભવતા પ્રશ્નો અંગે માહિતગાર થાય તેમજ તે પ્રશ્નોનું નિરાકરણ પણ કરી શકે. આ સમારોહના મુખ્ય મહેમાન અને જિલ્લા સમાહર્તા માન. કલેક્ટરશ્રી, શ્રી એમ. વાય. દક્ષિણીએ વિદ્યાર્થીઓને સરકારશ્રીની હાલમાં કાર્યોન્વિત કૃષિ વિકાસને લગતી યોજનાઓની માહિતીથી વાકેફ કરેલ, જેથી વિદ્યાર્થીઓ પણ પોતાના આજુ બાજુના વિસ્તારના ખેડૂતમિત્રોને કૃષિ લક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરી શકે, તેમજ તેઓશ્રીએ તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી આર્શિવચન આપેલ.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને માન. કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ડો. કે. બી.કથીરીયાએ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કરી તેઓને ડિપ્લોમા થી ડૉક્ટરેટ સુધીની પદવી મેળવી રાજ્યના કૃષિ વિકાસમાં યોગદાન આપે તેવા શુભ આપિશ આપેલ તેમજ તેઓશ્રીએ આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવા બદલ આ કાર્ય સાથે સંકળાયેલ સૌને અભિનંદન પાઠવેલ.

સમગ્ર સમારોહ પ્રવર્તમાન કોવીડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારશ્રીની ગાઈડલાઈન્સનો અમલ કરી મર્યાદિત મહેમાનો અને વિદ્યાર્થીઓ સાથે યોજાયેલ.

